

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં ઉતારાઓને 100,000 મારસ્ક્સ વિતરિત કરશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 11, 2020) – જૂન 10 નાં રોજ, કાઉન્સિલ વતી, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) દ્વારા, ઘોષણા થઈ હતી કે જૂન 22 નાં અઠવાડિયાથી શરૂ કરીને, સીટી ઓફ બ્રેમ્પટનના રિઓર્ગનીંગ અને રિકવરી પ્લાનના પ્રથમ પગલા તરીકે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના ઉતારાઓને, પુરવઠો રહે ત્યાં સુધી 100,000 નોન-મેડિકલ મારસ્ક્સ મફતમાં વિતરિત કરશે.

નોન-મેડિકલ મારસ્ક્સ બ્રેમ્પટન ટ્રાન્ઝિટના બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉન ટર્મિનલ્સ પર વિતરિત કરવામાં આવશે.

વધુ વિગતોની ઘોષણા આગામી અઠવાડિયામાં કરવામાં આવશે.

પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની પબ્લિક ટ્રાન્ઝિટમાં મારસ્ક્સ પહેરવાની ભલામણને અનુસરતા, હાલમાં, બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારાઓને બસોમાં અને ટર્મિનલો પર નોન-મેડિકલ મારસ્ક્સ પહેરવાની કડક ભલામણ કરવામાં આવે છે. જુલાઈ 2 થી શરૂ કરીને, બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારાઓ અને ઓપરેટરો માટે નોન-મેડિકલ મારસ્ક્સ પહેરવા અનિવાર્ય બનશે, જ્યારે ભાડું ચૂકવણી અને બસમાં આગળથી પ્રવેશ ફ્રી શરૂ કરવામાં આવશે.

માસ્ક્સ પહેરવા અનિવાર્ય રહેશે ત્યારે, બે વર્ષ નીચેની ઉંમરના અથવા અશક્ત બાળકો કે પોતાને માસ્ક પહેરતા રોકે તેવી અન્ય તબીબી સ્થિતિઓ ધરાવતા બાળકોએ માસ્ક પહેરવા જરૂરી રહેશે નહીં.

તમારા નોન-મેડિકલ માસ્ક યોગ્ય રીતે પહેરવા, બેસાડવા, કાઢી નાખવા અને સાફ રાખવાની રીત સહિત, નોન-મેડિકલ મારસ્ક્સના સંદર્ભમાં વધુ માહિતી માટે, પીલ પબ્લિક હેલ્થની [વેબસાઈટ](#) અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની [વેબસાઈટ](#) જુઓ.

COVID-19 સેફ્ટી મેઝર્સ (સુરક્ષા ઉપાયો)

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજ દા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી માસ્ક પહેર્યો હોય તો પણ ઉતારાઓને ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે ભૌતિક અંતર જાળવવાનું આચરણ ચાલુ રાખવાની વિનંતી કરે છે. સીટી ઉતારાઓને પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 મહામારી દરમિયાન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં સાથે ઘનિષ્ટપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

અવતરણો (ક્વોટ્સ):

“મને આ ઘોષણા કરવામાં ગૌરવ થાય છે કે અમે બ્રેમ્પટન ટ્રાન્ઝિટના ટર્મિનલો પર ઉતારાઓને 100,000 નોન-મેડિકલ મારસ્ક્સ વિતરિત કરીશું. જો તમે બ્રેમ્પટન ટ્રાન્ઝિટના ઉતારા હો તો, હું તમને બસોમાં અને ટર્મિનલો પર તમારી પોતાની અને અન્ય લોકોની સંભાળ લેવા નોન-

મેડિકલ માર્સ્ક ખરીદવાની અને પહેરવાની, અને દરેક વ્યક્તિના આરોગ્ય અને સુરક્ષા માટે તમારા નોન-મેડિકલ માર્સ્ક યોગ્ય રીતે પહેરવા, બેસાડવા, કાઢી નાખવા અને સાફ રાખવાની રીત અંગે પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોનું માર્ગદર્શન અનુસરવાની વિનંતી કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણી સીટી કાઉન્સિલ માટે આરોગ્ય અને સુરક્ષા ટોચની અગ્રતા છે, ખાસ કરીને COVID-19 દરમિયાન રહેવાસીઓ માટે સુરક્ષિત હેરફેર કરવાની વાત હોય. અમે ઉતારુઓ માટે બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં પ્રવાસ કરતી વખતે નોન-મેડિકલ માર્સ્ક મેળવવાનું વધારે સહેલું બનાવી રહ્યાં છીએ – તે તમારી રોજીંદી અવરજવર કરવા જેટલું સરળ રહેશે, પુરવઠો રહે ત્યાં સુધી.”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન ફરીથી ખુલી રહ્યું છે અને COVID-19 મહામારીમાંથી રિકવર થઈ રહ્યું છે ત્યારે, અમે આપણાં સમુદાય માટે આરોગ્યપ્રદ અને સુરક્ષિત ટ્રાન્ઝિટ સર્વિસ પૂરી પાડવા સમર્પિત છીએ. પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોના માર્ગદર્શન અનુસાર, અમે આ માર્સ્ક્સ ઉતારુઓના હાથોમાં આરોગ્યપ્રદ અને સુરક્ષિત રીતે પહોંચાડવા જરૂરી બધાં સુરક્ષા ઉપાયો કરી રહ્યાં છીએ.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca